

ડાંગર સંશોધન કેન્દ્ર, આકૃત્યુ, ડભોઈ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ડાંગર સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, ડભોઈ ખાતે તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમા કુલ ૫૫ જેટલા ખેડૂત ભાઈઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સદર કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી વિજયભાઈ સોલંકી, નાયબ નિયામકશ્રી, વોટર મેનેજમેન્ટ ફોરમ-અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી. ડી.કે.રાઠવા, એગ્રીકલ્ચર ઓફીસરએ કાર્યક્રમમાં આમંત્રિત સર્વેનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા આપણા દેશમાં કોરોના જેવી ગંભીર બીમારીથી અવસાન પામેલા ભાઈઓ તથા બેહેનોને ભાવપૂર્ણ શ્રંધ્યાજલી આપવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી. વિજયભાઈ સોલંકીએ સર્વે ખેડૂત મિત્રોને સિંચાઈ વ્યવસ્થાપન પર વક્તવ્ય આપ્યું હતું. સાહેબશ્રીએ, ખેડૂતભાઈઓને વધુમાં વધુ સુક્ષ્મ પદ્ધતિ અપનાવવા આગ્રહ કર્યો હતો. સિંચાઈ માટેની રૂઢીગત પદ્ધતિ પાણીનો વ્યય વધુ થાય છે અને જમીનની તંદુરસ્તીને પણ માઠી અસર થાય છે, તેમ સાહેબશ્રીએ ખેડૂતભાઈઓને જણાવ્યું હતું.

અત્રેની કચેરીના વડાશ્રી એ.જી.પંપાણીયા સાહેબે ખેડૂતોને ઘઉંની આધુનિક ખેતી પદ્ધતિ વિશે સમજણ આપી. ઘઉંની ટુકડી જાત GW ૪૯૬ કરતા ખેડૂતભાઈઓને વર્ષ ૨૦૧૫માં બહાર પડેલ જાત GW ૪૫૧ કે જે મોટા દાણાવાળી જાત છે. તેનું પણ વાવેતર કરવા સમજાવ્યું. વધુમાં કેન્દ્ર ખાતેની કામગીરીથી ખેડૂત ભાઈઓને અવગત કરવ્યા હતાં.

સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત સિનિયર રિસર્ચ ફેલો, ડૉ.વિપુલ પટેલ સાહેબે ખેડૂતોને ઘઉં પાકમાં સંકલિત નિંદણ વ્યવસ્થાપન વિશે વક્તવ્ય આપ્યું હતું. ઘઉં પાકમાં થતા મુખ્ય એકદળી અને દ્વીદળી નિંદણની ઓળખ સાથે એકજ છંટકાવમાં બધાજ પ્રકારનાં નિંદણનો નાશ થઈ શકે તેવી પૂર્વમિશ્રિત નિંદણનાશક દવાનો ફ્લેટ ફેન નોઝલથી છંટકાવા કરવાની ભલામણ કરી હતી.

એગ્રીકલ્ચર ઓફીસર, શ્રી.ધનસિંગ રાઠવા સાહેબે નાડેપ કમ્પોસ્ટ અને જૈવિક ખાતરની ઉપયોગિતા વિશે ખેડૂત મિત્રો ને જણાકારી આપી હતી, અને અંતે ખેડૂત મિત્રો સાથે ચર્ચા પરામર્શ અને આભાર વ્યક્ત કરી સર્વે ખેડૂત મિત્રો સાથે ભોજન વિરામ કરી ને આદર્શ જમીનનો જમુના લેવાની રીત પ્રાયોગિક રીતે સમજાવી અને અત્રેના મોડેલ ફાર્મની મુલાકત લીઈ સર્વે ખેડૂત મિત્રોએ વિદાય લીધી.

